

Frequently Asked Questions

વિદ્યાર્થીઓ ને વારંવાર મુંજવતા પ્રશ્નો

૧. વિદ્યાર્થી: હું એપ્લીકેશન ફોર્મની ફી કેવી રીતે ભરું?

જવાબ: આ માટે આપને બે મોડ પ્રાપ્ય છે.

અ. ઓનલાઈન ડેબીટ કાર્ડ / ક્રેડીટ કાર્ડ / ઈન્ટરનેટ બેન્કિંગ દ્વારા. જે માટે લાગતો બેંક સર્વિસ ચાર્જ ચલણ કરતા ખુબ ઓછો છે. કોઈ પણ બેંકનું માન્ય કાર્ડ વાપરી શકાશે. ખુબજ સરળ તથા ઝડપી વિકલ્પ છે. આ માટે લગતા ચાર્જિસ નું કોષ્ટક આપ લોગીન માંથી મોડ સેલેક્ટ કરો પેમેન્ટ નો ત્યારે જોઈ શકો છો.

બ. જો ઉપરોક્ત વિકલ્પ માટે સગવડ ન હોય તો યુનિયન બેંક ની કોઈ પણ નજીકની શાખામાં પ્રિન્ટ કરેલ ચલણ દ્વારા. જેનો બેંક સર્વિસ ચાર્જ ચલણમાં દર્શાવેલ છે અને ચલણ થી ફી ભર્યા બાદ ૪૮ કલાક પછી જ આપ આપના લોગીન માંથી એપ્લીકેશન ની પ્રિન્ટ કાઢી શકો છો. ચલણ ની પ્રિન્ટ કાઢ્યાના બીજા વર્કિંગ ડે થી જ ચલણ બેંકમા જમા કરાવી શકાય છે. જેનું ખાસ દયાન રાખવું.

૨. વિદ્યાર્થી: શું હું એક પ્રોફાઈલ દ્વારા એક થી વધારે કોલેજો તથા એક થી વધારે અભ્યાસક્રમો કે જેમાં હું પ્રવેશ લાયકાત ધરાવતો હોઉં તે માટે અરજી કરી શકું?

જવાબ : હા જરૂર. આપે એકજ પ્રોફાઈલ બનાવવાની રહેશે. પરંતુ જેટલા અભ્યાસ ક્રમો માટે જેટલી કોલેજોમા ચાન્સ કે પ્રવેશ લેવા માંગતા હોવ તે દરેક માટે તેજ પ્રોફાઈલ દ્વારા અલગ અલગ અરજી કરવાની રહેશે તથા અલગ અલગ તમામ

ફોર્મ જમા કરાવવાના રહેશે. પ્રવેશ માટે ની તારીખો શરૂ થઈ નહિ હોય તો પણ પ્રોફાઈલ ભરી ને રાખી શકાશે. પરંતુ કન્ફર્મ કરવી નહિ.

૩. એપ્લિકેશન ની ફી દરેક એપ્લિકેશન દીઠ છે?

જવાબ : હા. તે એપ્લિકેશન દીઠ રહેશે.

૪. વિદ્યાર્થી: જેતે કોલેજ નું ફોર્મ ભરાઈ ગયા બાદ મેરીટ તથા પ્રવેશ કાર્યવાહી ક્યાં થાશે? એડમીશન ફી ક્યાં જમા કરાવવાની થશે?

જવાબ : જેતે કોલેજ દ્વારા જ મેરીટ તથા પ્રવેશ કાર્યવાહી હાથ ધરાશે અને એડમીશન કન્ફર્મ થતાં ફી કોલેજ માં ભરવાની રહેશે.

૫. એપ્લિકેશન ફી પાછી મળી શકે?

જવાબ: એપ્લિકેશન ફી કોઈ પણ સંજોગો માં નોન રીફન્ડેબલ છે.

૬. વિદ્યાર્થી: પ્રોફાઈલ ગમે ત્યારે ભરી શકાય?

જવાબ: હા. પ્રોફાઈલ ગમે ત્યારે ભરી શકાય. માહિતી જેવી કે ફોટો, સિગ્નેચર, પેર્સનલ ડીટેઇલ, રેઝરવેશન ડીટેઇલ, એડ્રેસ ડીટેઇલ જેવી માહિતી ભરી પ્રોફાઈલ તૈયાર રાખી શકાય. કોલેજ તથા અભ્યાસક્રમ ની પસંદગી યુનિ. દ્વારા આપેલ તારીખોમાં જ કરી શકાશે.

૭. વિદ્યાર્થી: ચલણ થી ફી ભરાયા બાદ એપ્લિકેશન ની પ્રિન્ટ નીકળતી નથી

જવાબ. ચલણ બેંક મા જમા થયા બાદ બેક ને ૨૪ કલાક (પછીના વર્કિંગ ડે) જેટલો સમય રીકનસીલેસન માટે લાગે છે. ત્યાર બાદ લોગીન માંથી પ્રિન્ટ કાઢી શકાશે.

૮ વિદ્યાર્થી: પ્રોફાઈલ ભરાઈ ગયા બાદ તથા કન્ફર્મ કાર્ય બાદ નામ કે અન્ય કોઈ વિગતો મા સુધારો કરી શકાય?

જવાબ: ના. એક વખત પ્રોફાઈલ કન્ફર્મ કાર્ય બાદ કોઈ સુધારો પ્રોફાઈલ માં કરી શકાશે નહિ. ‘*’ કરેલી અચૂક ભરવાની થતી વિગતો મા જો કોઈ ભૂલ રહી ગયેલ હોય તો એપ્લીકેસન સાથે આચાર્યશ્રી/અધ્યક્ષશ્રી ના નામ ની અરજી લખી એપ્લીકેસન ફોર્મ સાથે જેતે કોલેજ / ભવન / હેલ્પ સેન્ટરમાં જમા કરાવવી

૯. વિદ્યાર્થી: ઓનલાઈન અરજી કરેલ છે પરંતુ ફોર્મ જમા કરાવેલ નથી તો પ્રવેશ મળશે?

જવાબ: ના. ફોર્મ ની પ્રિન્ટ કે જે લોગીન માંથી એપ્લીકેસન ની ફી જમા કરાવ્યા બાદ લઈ શકાય છે તે જેતે કોલેજ / જણાવાયેલ હેલ્પ સેન્ટર / ભવન મા જમા કરાવવી ફરજિયાત છે.

૧૦. વિદ્યાર્થી : હું એપ્લીકેસન ફોર્મ ની પ્રિન્ટ જમા કરું, તેનો મારી પાસે શું આધાર રહેશે?

જવાબ: વિદ્યાર્થી એ ફોર્મ ની બે પ્રિન્ટ કાઢવાની છે. એક કોલેજ મા જમાં કરાવવાની રહેશે. બીજી કોપી જ્યાં જમા કરવો તે કોલેજ / હેલ્પ સેન્ટર ના એડ્મીસન ક્લાર્ક નો કોલેજ સિક્કો તથા તારીખ અંકિત કરાવવાની રહેશે. કોલેજ આપેલ પહોંચ મેળવવાનીરહેશે. જે તમારો ફોર્મ જમા કાર્ય નો આધાર છે.

૧૧ વિદ્યાર્થી: મે ઓનલાઈન ફોર્મ ભરેલ છે. મારો પ્રવેશ ફાઈનલ ગણાશે ને?

જવાબ: ના. ઓનલાઈન એપ્લીકેસન કાર્ય બાદ, જે તે કોલેજ / ભવન ની પ્રવેશ કાર્યવાહી કે જે મેરીટ તથા અનામત ના નિયમાનુસાર થશે તે મુજબ આપ નો પ્રવેશ નિયમ મુજબ ફાઈનલ લેખાશે તથા એડમિસન ની ફી સ્વીકારાશે.

૧૨. વિદ્યાર્થી : મારે બારમાં ધોરણ ની વિગત ભરતી વખતે માર્ક એન્ટર કરવા કે ગ્રેડ.

જવાબ : આપે બારમાં ધોરણ મા મેળવેલ કુલ માર્ક માંથી મેળવેલ માર્ક એન્ટર કરવાના રહેશે.

૧૩. વિદ્યાર્થી: હું દસમાં, બારમાં તથા ગ્રેજ્યુએશન ની માહિતી ભરતી વખતે માર્ક એન્ટર કરું કે ગ્રેડ?

જવાબ: આપે કુલ ગુણ માંથી મેળવેલ ગુણ ગુણ (Obtained Marks – Out of – Grant Total Marks) એન્ટર કરવાના રહેશે. દસમાં, બારમાં, ગ્રેજ્યુએસન, તથા અનુસ્નાતકની માહિતીમાં પણ .

૧૪. વિદ્યાર્થી: મને કોઈજ હેલ્પ મળતી નથી અથવા મને મુજવણ છે ક્યાંથી મદદ મેળવવી?

જવાબ : આપ હેલ્પ સેન્ટર ની માહિતીમાં જણાવ્યા અનુસારની કોલેજોમાં/ભાવનોમાં જેતે જણાવેલ અભ્યાસક્રમ વેશે માહિતી મેળવી શકો છો. અન્યથા કચ્છ યુની. ના હેલ્પ સેન્ટર પર પણ સંપર્ક કરી શકો છો. comp.dept.kskvku@gmail.com પર ઈમેઈલ પણ કરી શકો છો.

